

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનવાસીઓને MPACના voterlookup.ca પર વિગતો તપાસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (14 એપ્રિલ 2022) – ઓક્ટોબરમાં આવનારી 2022 બ્રેમ્પટન નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં 200 કરતા ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે, મતદાન માટેનું આયોજન શરૂ કરવાનો સમય પાકી ગયો છે. સિટી ઓફ બ્રેમ્પટન તેમના રહેવાસીઓને ની મુલાકાત લેવા voterlookup.ca તે સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરે છે કે શું તમનો સમાવેશ પ્રાથમિક મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે કે કેમ અને શું તમની તમામ માહિતી સાચી છે કે કેમ.

મ્યુનિસિપલ પ્રોપર્ટી અસેસમેન્ટ કોર્પોરેશન (MPAC) મતદારોની પ્રાથમિક યાદી જાળવે છે, જેનો ઉપયોગ ચૂંટણી માટે મતદારોની યાદી તૈયાર કરવા માટે થાય છે. Voterlookup.ca MPAC દ્વારા પૂરી પાડવામાં આવેલ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી ઓનલાઇન સેવા છે.

મુખ્ય મુદ્દાઓ:

- 2022ની બ્રેમ્પટન મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં લાયકાત ધરાવતા મતદાર એવી વ્યક્તિ છે જેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોય, કેનેડાના નાગરિક હોય અને બ્રેમ્પટનના રહેવાસી હોય, અથવા બ્રેમ્પટનમાં મિલકતના માલિક અથવા ભાડૂત હોય અથવા આવા માલિકની પત્ની અથવા ભાડૂત હોય.
- આગામી નગરપાલિકા ચૂંટણી માટે તમારી માહિતી ચોક્કસ રીતે રેકોર્ડ કરવામાં આવી છે તેની ખાતરી કરવા માટે, voterlookup.ca પર જાઓ, અને તમારી નગરપાલિકા અને પૂરું નામ, જન્મતારીખ અને ક્યાં તો તમારી મિલકતનું સરનામું અથવા આકારણી રોલ નંબર દાખલ કરો.
- જો તમે અગાઉની નગરપાલિકા ચૂંટણીમાં મતદારોની યાદીમાં હતાં તેમ છતાં, તમારી વિગતો સચોટ છે કે કેમ તે ચકાસવા માટે હવે યાદી તપાસો.
- જો તમે છેલ્લાં થોડાક વર્ષોમાં 18 વર્ષના થયા હો, તાજેતરમાં બ્રેમ્પટનમાં કે તેની અંદર રહેવા ગયા હો અથવા નવા કેનેડાના નાગરિક હો, તો તમારી માહિતી voterlookup.ca પર અપડેટ કરો.
- પ્રોવિંશલ ચૂંટણી પણ આ વર્ષે 2 જૂને થઈ રહી છે. રહેવાસીઓને તેમની માહિતીની પુષ્ટિ કરવા અથવા અપડેટ કરવા eregistration.elections.on.ca પર પ્રોવિંશલ મતદારોની યાદી તપાસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વધુ જાણવા માટે અહીં મુલાકાત લો voterlookup.ca અથવા MPACનો સંપર્ક 1.866.296.6722 પર અથવા TTY 1.877.889.6722 પર કરો.

સુવાક્ય

“MPACના voterlookup.ca પર તમારી માહિતીને સમર્થન આપવું તે 2022 બ્રેમ્પટન નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં મત આપવાની તૈયારીનું મહત્ત્વનું પગલું છે.. લાયકાત ધરાવતા મતદારો મતદાનના દિવસે તેમના મતદાન સ્થળ પર સમયની બચત કરવા માટે યાદીમાંની પોતાની માહિતી અદ્યતન અને સચોટ છે કે કેમ તેની ખાતરી કરી શકે છે.”

- પીટર ફ્રે, સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca